

SEC/BM/SE/ /2020-21

May 21, 2021

CORPORATE COMPLIANCE CELL - LISTING BOMBAY STOCK EXCHANGE LIMITED PHEROZA JEEJEEBHOY TOWERS, 25TH FLOOR, DALAL STREET, BOMBAY-1.

E-Mail: corp.relations@bseindia.com

Ref: - Scrip Code/ SYMBOL: - 505807 / ROLCOEN

Dear Sir/Mam,

Sub.: Publication of Board Meeting notice in Newpaper

Pursuant to regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligation and Disclosure Requirement) Regulations, 2015, we hereby inform you that notice for Board Meeting of the company held on May 28, 2021 has been published in Western Times on May 21, 2021.

Copies of the same are enclosed for your reference.

Kindly, take the same on record.

Thanking You,

Yours Faithfully,

FOR ROLCON ENGINEERING CO. LTD

(CSTDMARMESH CHAUHAN)

COMPANY SECRETARY & COMPLIANCE OFFICER

M.No.: A40003

Encl.: As above.



Regd. Office: Anand-Sojitra Road, Vallabh Vidyanagar - 388 120, Anand, Gujarat, India. CIN: L29259GJ1961PLC001439, Phone: 02692-230766/230866, Web:- www.rolconengineering.com Email:- rolcon@rolconengineering.com

SK Innovation, Ford to launch EV battery joint venture in US

South Korean battery maker SK Innovation and American automaker Ford

Motor are set to announce a battery joint venture in the United States to ensure a stable supply of batteries for electric vehicles, industry sources said on Thursday.

The two companies plan to announce a memorandum of understanding on the joint venture later in the day, as South Korean President Moon Jae-in meets with U.S. President Joe Biden in Washington this week to discuss bilateral issues, including EV industry cooperation, sources familiar with the matter told Yonhap news agency.

SK Innovation, a refinery-and-battery unit under South Korea's No. 3 conglomerate SK Group, has been building a \$2.6 billion battery factory in Georgia, which will supply batteries for Ford's F-150 EVs.

The joint venture deal comes after SK Innovation last month agreed to pay \$1.8 billion to its bigger home rival LG Energy Solution to settle a battery trade secret case, which had clouded its EV battery business in the US.

The settlement averted the worst-case scenario for SK, which would have had to abandon its Georgia factory if the 10-year import ban took effect, weighing administration's EV push.

The SK-Ford partnership is expected to be similar to what LG Energy has with [^]American automaker, General Motors, with the two jointly building battery factories in Ohio and Tennessee.

SK Innovation aims to expand its global battery production capacity to 85 GWh in 2023 and over 125 GWh by 2025, which can power about 1.8 million EVs, and Ford announced a \$22 billion investment plan through 2025 to speed up its EV transition.

The JV battery deal is expected to spice up the upcoming bilateral summit as Biden has made boosting EVs a top priority for his \$2 trillion infrastructure

Biden pitched his \$174 billion EV proposal during his visit to Ford's EV plant in Michigan earlier this week, and Moon plans to stop over at SK Innovation's Georgia plant on his way back home.

Lockdowns may affect children's fitness: Study London, Healthy Fitness Zone Journal of Pediatrics, in-

Strict lockdowns can reduce the spread of Covid-19, but might be responsible for delaying normal cardiorespiratory development in children, according to a research.

The study, led by a team of researchers from Anglia Ruskin University (ARU) in the UK and University (ARU) in the UK and University of Zaragoza in Spain, showed that boys and girls aged 12-14 showed lower levels of cardiorespiratory fitness than would be expected with normal VO2 max rate denormal VO2 max rate development.

VO2 max is a wellknown cardiorespiratory fitness indicator and levels increase during adoles-cence, in line with physical growth and development.

measure of health based on age and sex -- also fell by 3.4 per cent over the 12-month period.

"In normal conditions, VO2 max levels tend to increase in adolescents up to a certain age. In our study, each age and sex subgroup showed lower levels in relation to normal VO2 max rate development and specific subgroups, such as boys aged 12 and girls agéd 14, displayed reductions in their actual VO2 max levels, which could underscore a higher vulnerability in these groups," said Lee Smith, Reader in Physical Activity and Public Health at ARÚ.

The research, pub-lished in the European

dren from a school in north-eastern Spain. The country introduced a strict six-week lockdown in spring 2020, during which under-15s were unable to leave their homes except for medical reasons.

The children, aged 12-14, took part in fitness tests to measure their maximal oxygen uptake (VO2 max) in November 2019, before the start of the Covid-19 pandemic, and repeated the fitness tests in Novem-

The research VO2 max is a well-known cardiorespiratory fitness indicator and levels increase during adolescence, in line with physical growth and development.

New rapid antigen test can detect Covid in saliva accurately

Scientists have shown that an antigen-based test for quantifying SARS-CoV-2, the virus behind Covid-19, in saliva samples is simple, accurate, rapid, and more conducive for mass-screening.A team of scientists from Hokkaido University in Japan used a novel antigen-based kit, Lumipulse SARS-CoV-2 Ag kit (Lumipulse), developed by a Japanese company Fujirebio in June 2020 to assess the efficiency and accuracy of the test compared to RT-PCR.

Their findings show that the antigen detection kit, which is used to perform chlly confirmed Covid-19, individuals who had contacteemiluminescent enzyme immunoassay (CLEIA), can detect SARS-CoV-2 within 35 minutes and with good accuracy. The study was published in the journal The Lancet Microbe.

The scientists tested 2,056 individuals from three cohorts: patients with clinically confirmed Covid-19, individuals who had contacted patients with Covid-19, and individuals tested on arrival at Tokyo and Kansai International

The benefit of using saliva samples is the ease of collection: it is quick and can be collected by the individuals being tested, reducing the risk that healthcare workers are

Furthermore, self-collection of saliva allows multiple samples to be collected simultaneously for expeditious screening of visitors at large gatherings.

Hypertension, tobacco top most

isting hypertension.

The above was meninterventional Cardiologist Dr. (Prof) (Col.) Shekhar Kashyap while speaking at a webinar on 'Hypertension, COVID-19 and Tobacco? A DeadlyTriad'.

Kashyap is the former Head of Department (Cardi-

Of this, nearly 3GW run

the risk of re-auction or can-

cellation because their tar-

iffs are comparatively higher

at over Rs 2.75 per unit - a

good 75 paise more than

the recently discovered tar-

may have some hope be-

cause CRISIL expects 25-50

paise increase in tariffs at

applicable on import of

solar cells and solar mod-

ules. That means the tariff

differential between

projects sans PSAs but

with tariffs below Rs 2.753,

and those to be auctioned

for discoms, already short

on their renewable tar-

It would also be faster

will be display on website only).

next, will narrow.

The remaining 4 GW

lobby promotes that nico-tine does not cause hypertension, it affects all the organ systems. Tobacco consumption in any form be it cigarettes, chewable, and nicotine gum, causes increase in blood pressure and elevates the heart rates. Nicotine cessation can help immediately. Within 20 minutes of cessation, blood pressure returns to normal and 15 years of cessation eliminates all hazards of

smoking," added Kashyap.

Hypertension is the
most widely prevalent vascular disease among the low and middle income group countries. It is also one of the biggest causes of premature

deaths in the world. Today, one in every four

Those who consume tobacco have poorly controlled hypertension. It is a myth that smokeless tobacco or non-combustible tobacco has no ill-effects. There are ample studies to prove that these cause many diseases," Kashyap said, adding that tobacco blunts the effects of medicines taken to stabilise blood pressure.

Kashyap said persons with cardiometabolic fac-tors face a higher risk of se-vere Covid-19 condition along with complications and mortality. Chewing tobacco can increase the risk of Covid-19 as the person does not wear a mark, the hand to mouth contact inting puts others at risk, and sitting together to drink and smoke leaves no room for social distancing, thereby increasing the risk of spreading the infection.

"To counter the threat of Covid-19, it is imperative to combat the misinformation campaigns. The studies that purportedly claim consumption of alcohol or smoking can prevent Covid-19, may be manipulated and, therefore, as a vigilant society, there needs to be a high index of suspicion around such studies, he added. Kashyap advised that people should rely on information and guidelines from credible sources such as the WHO, US CDC, Ministry of Health and Family

diesel prices every morning benchmarking retail fuel

prices to a 15-day rolling average of global refined

products' prices and dollar

exchange rate. However, in a

market where fuel prices

need to be increased suc-

cessively, alternate day price

revision seems to be the

causes of premature mortality women today are suffering "Although the tobacco Hypertension and tofrom hypertension.

bacco are the top most causes of premature mortality and people consuming tóbacco in any form are at high risk of many diseases, as nicotine is solely responsible for constricted arteries, heart failure, inflammation, many types of cancers, blindness, and gangrene, while it also complicates exwhile it also complicates ex-

ology), Army's Research & Referral Hospital in New

Consumers spared of hike; petrol,

tise. Accordingly, the Wednesday's price hold

came after there was an increase in prices on Tuesday.

These was no price increase

petrol and diesel prices

were raised by 24 and 27

paisa per litre respectively,

there was no price revision

on Saturday. Similarly, while

fuel prices were raised on

Also, on Sunday while

on Monday as well.

Consumers have been spared of another increase in auto fuel prices with oil marketing companies (OMCs) deciding to keep petrol and diesel rates un-

This is second consecutive day of fuel price pause and follows slight softening in global oil market over demand concerns prime markets in Asia seeing rising

of another increase, the price of petrol continues to

Across the country as well the petrol and diesel price remained static on Thursday but its actual retail prices varied depending on the level of local levies in re-

Before Thursday, OMC

diesel prices unchanged on Thursday one week rather than un-Friday, it remained undertaking changes on a changed in the previous daily basis as has been pracday. Under daily price revision, OMCs revise petrol and

changed on Thursday.

cases of coronavirus. With fuel prices spared

remain at Wednesday's level of Rs 92.85 a litre and diesel Rs 83.51 per litre in Delhi.

spective states.

were revising fuel prices on every alternate day for last

Ratadiva Village Water and **Sanitation Committee**

Taluka: Bhuj, District: Kachchh Tender Notice No. 39, Year: 2020-21-3rd Attempt

Ratadiya VWSC invites e-tender from eligible agencies / parties for implementation/execution of approved civil works Estimated cost of Rs 35.46 Lakhs (e-tender I.D. No. 458884) pertaining to in village water supply scheme under "Augmentation in tap connectivity in rural Area/JJM Programme" The last date of submission of bid for eligible bidders as per tender norms is 02.06.2021 up to 18:00 hrs For further information the interested bidders may contact the Adyaksh/Sarpanch of Ratadiya Pan Samiti on + 91 94275 66699. All the uploaded documents are to be sent/submitted to Unit Manager, WASMO-Bhuj, Kachchh within prescribed time limit through RPAD/Speed post only. Tender I.D. and name of work should be clearly mention on envelop. If any changes in this tender will be uploaded on-line through concerned website. The tender submitted through post/off-line will not be considered. The authority to accept/reject all the bids without giving any reason lies with Ratadiya Pani Samiti. Web Site www.wasmo.nprocure.com.

(DDI/KUTCH/168/2021)

primarily because subseof developers since implethe upcoming auctions bequent auctions saw tariffs mentation and debt drawcause new projects will have plummeting and even fallto bear basic customs duty downs have not vet started and project viability remains

WESTERN RAILWAY-AHMEDABAD

TENDER NOTICE FOR

ELECTRIFICATION WORKS

7 GW of unsigned PSAs

pose risk to RE targets: Crisil

(Seci) and the National Ther-

mal Power Corporation

(Ntpc) - and are awaiting

PSAs with the ultimate

counterparties, the state dis-

According to Hetal Gandhi, Director, CRISIL Re-

search, "The PSAs for the 7

GW of projects bid out at

auctions prior to February

2020 are yet to be signed

tribution

companies

-TENDER NOTICE No: EL/C/ADI/GS/ These projects were auc-44/2020-21. Name of Work with its ocation: Electrification of different type central f Service buildings, Offices, Cable Hut counterpartiés - the Solar LC gates, Platforms, Cover Sheds 8 Energy Corporation of India Staff Quarters between Surendranagar-Rajkot section in connection with Surendranagar-Rajkot-Doubling of oroad gauge single line section (Balance Vork). Approx. Cost of the work: 2 11.78.979/- Earnest Money to be deposited: As specified on IREPS portal. Date & Time for submission and opening of bid: As specified or IREPS portal Tender fees: As specified on IREPS portal Completion Period of work: 06 Months. Website particular and Notice board where details of ender can be seen & address of the office: www.ireps.gov.in, Notice board and office of the Dy.Chief Electrical Engineer (Construction) Wester

> Dv. Chief Electrical Engineer (Construction) PM-05 Western Railway, Ahmedabad Like us on : f facebook.com/WesternRly

DDI/BVN/99/21-22

PUBLIC NOTICE

ON LINE TENDER NOTICE NO: 4 for 2021-22

Phone No. 0278-2516899 invites on-line tenders 3 works, total

estimated cost Rs.65.33 lakhs. Tender Documents

downloading end date is 26.05.2021 on web site

www.nprocure.com and also on Information Department web

site: www.statetenders.com (Any modification / Correction

Executive Engineer, (R&B) Division, Panwadi, Bhavnagar

ENVIRONMENTALCLEARANCE It is hereby informed that the State Level Environment Impact Assessment Authority (SEIAA), Paryavaran Bhavan, Sector – 10A. Gandhinagar - 382 010, has accorded Environmental Clearance for Proposed Bulk Drug and Drug Intermediates Manufacturing Unit by **M/s. Yida Chemicals Pvt. Ltd.** at Plot No. 301 TC 430 + 433 TO 440/2/2, Saykha Industrial Estate, Tehsil: Vagra Dist. Bharuch - 392140, Gujarat vide letter No. SEIAA/GUJ/EC 5(f)/596/2021 dated 11th May, 2021 under the provision of EIA Notification dated 14th September 2006.

Copies of Clearance letter are available at GPCB and on websit

Date: 20/05/2021

AUTHORIZEDSIGNATORY M/S.YIDACHEMICALSPVT.LTD.

ROLCON ENGINEERING COMPANY LTD.

CIN: L29259GJ1961PLC001439

Reg. Office: Anand- Sojitra Road, Vallabh Vidyanagar-388120 (Gujarat) E-mail: rolcon@rolconengineering.com, web: www.rolconengineering.com

NOTICE

Notice is hereby given that the meeting of the Board of Directors of the Company will be held on Friday, May 28, 2021, at 4:30 p.m. at Registered office of the Company, to inter alia, to consider, take on record and approve the Audited Standalone and Consolidated Financial Result of the Company for the quarter and financial year ended on March 31, 2021, along with other agenda if any.

For, ROLCON ENGINEERING CO. LTD.

Place: Vallabh Vidyanagar : May 20, 2021

Sd/- ASHISH S. AMIN (Managing Director) (DIN: 01130354)

WESTERN RAILWAY-AHMEDABAD (SURVEY & CONSTRUCTION), E- TENDER NOTICE

E-Tender Notice No. Dy. CE(C)III/ADI/VG-SIOB/53(RI) & Dy. CE(C)III/ADI/SUK-DHNL/54 Date: 19.05.2021

Dy. Chief Engineer (Construction) III, Near Sahar Kotda Police Station, Saraspur, PO Railwaypura, Western Railway, Ahmedabad-380002 for & on behalf of Presid Union of India invites E-Tender for the following work:

- 1	(1) E-Tender No.	Dy. CE(C	Dy. CE(C)III/ADI/VG-SIOB/ 53 (RI)	
	Name of Work	Supply of 50,000 Cum machine crushed stone ballast in Ballast Depot at Jhund in connection with Viramgam - Samakhiyali Doubling project of Western Railway.		
	Approx. cost of Work	₹3,93,00,000/-		
	EMD	NIL		
M	Completion period	05 (Five) Months (Including Monsoon)		
T	Closing time & Date for submission & opening of Bid :			
- 1	(i) Closing time & Date		10/06/2021 at 15:00 Hrs.	
١	(ii) Opening time & Date of Bid		at 16:00 Hrs. on 10.06.2021	
١	(2) E-Tender No.	Dy. CE(C)III/ADI/SUK-DHNL/54		
	Name of Work	Construction of miscellaneous balance work i.e. providing toe wall for protection of newly bank, drop/curtain wall, ballast wall at formation level, central drain between both track, pitching and cess repairing etc.		

between SUK-DHNL of VG-SIOB section in c/w compliance of CRS Inspection Approx. cost of Work ₹4.58.83.927.65/-EMD Completion period 05 (Five) Months (Including Monsoon)

03/06/2021 at 15:00 Hrs (ii) Opening time & Date of Bid at 16:00 Hrs. on 03.06.2021 Website particulars Notice board location where complete details of tender car be seen and address of the office: www.ireps.gov.in Office of Dy. Chief Engine (Construction) III, Near Sahar Kotda Police Station, Saraspur, PO: Railwaypur Western Railway, Ahmedabad-380002. Telephone No. 079-22921510

Dy. Chief Engineer (Construction) II

Business Brief III

MAS Fin. Services' Q4 FY2021 PAT at Rs. 36.53 crore, up by 6%

Ahmedabad-based MAS Financial Services Ltd, specialized in SME financing, has announced the audited financial results for the year and quarter ended 31st March, 2021. The company has reported a net profit of Rs. 36.53 crore for the quarter ended on 31st March, 2021 which was higher by 5.88% than Rs. 34.50 crore net profit in the quarter ended on 31st March, 2020. MAS Financial Services' total income was at Rs. 139.15 crore in the Q4 FY21 which was at Rs. 169.89 crore in the same period of last financial

The AUM of the company was Rs. 5,372.44 crore in the Q4 FY21 which was Rs. 5,966.28 in Q4 FY20. The contraction of 9.95% in AUM over the corresponding period of the previous year, due to adoption of cautious approach on disbursement while maintaining high collection efficiency.
Commenting on the performance, Mr. Kamlesh

Gandhi - Founder, Chairman & Managing Director, MAS Financial said, "In consonance with our mission and vision of creating value for stakeholders on a very large scale through efficient last mile delivery of credit, the main focus of the company continues to remain on maintaining strong capital base, high level of liquidity, the quality of assets, high provisioning buffers and constant engagement with all the stakeholders for understanding the evolving situa-

The total special COVID provision as on 31st March 2021 stood at Rs. 56.23 crore for the total on book assets of Rs. 4049.75 crores i.e. 1.39 %. The additional special COVID provision during the FY 2021 was Rs. 35.90 crore. The special COVID provision during FY 2020 was Rs. 20.33 Crore.

POCO M3 Pro 5G unveiled with Dimensity 700, 90Hz display

Chinese smartphone brand POCO has unveiled a new smartphone -- M3 Pro 5G -- that comes with a faster 90Hz screen and a faster chipset. The POCO M3 Pro 5G with 4GB RAM and 64GB

model starts at 180 euros, the 6GB and 128GB version is 200 euros. However, the company is offering early bird deals, which

drop the price to 160 euros and 180 euros, respectively. The smartphone is available in poco yellow, power black and cool blue, the company said in a statement.The smartphone fea-

tures a 6.5-inch 1080p+ LCD with 400 nits typical brightness and Gorilla Glass 3. It sports 48MP primary

camera on the rear and two 2MP cameras? macro and depth. There's an 8MP camera on the front. The company picked the 7nm Dimensity 700 chip

to power its new creation. It has peak download speeds of up to 2.77 Gbps and a pair of Cortex-A76 cores, plus a Mali G57 GPU, reports GSMArena. The POCO M3 Pro 5G has a 5,000mAh battery, a 3.5mm jack, an infrared blaster and this one will even have NFC in some regions. It comes with a newer Android version out of the box, Android 11, with MIUI 12 on

Global cues subdue equity markets, metal stocks fall

Mumbai,

Mixed global cues subdued India's benchmark stock indices during the pre-noon trade session on Thursday. At 11.50 a.m., the S&P BSE Sensex traded at 49,921.61, higher by 18.97 points, or 0.04 per cent, from its previous close. Similarly, the Nifty50 of the National Stock Exchange traded at 15,014.25, up by 15.90 points, or 0.11 per cent, from its previous close.

Besides, both the key indices started on a positive note with a gap up opening, however, ceding their initial gains soon afterwards.

Globally, Asian stock markets traded on a mixed note. Sector-wise, losses were witnessed in the metal and oil and gas stocks. "After a significant rise in the market on Monday and Tuesday on account of lower Covid infection cases, for last 2 days markets are trading in a narrow range of 200 points (14950-15150). Short-term trend in the market is slightly bearish,' said Gaurav Garg, Head of Research at CapitalVia.

"Markets are expected to be range bound till the time we get a closing outside this range. For today's weekly expiry, Nifty is likely to trade between 14,950-

Gadkari writes to Goyal on jewellers demand

Nitin Gadkari, Road Transport and MSME Minis-

Ahmedabad, Page 7

ter, has written to Commerce and Industry Minister Piyush Goyal on a representation by the gems and jewellery sector seeking deferment of mandatory hallmarking up to June 2022. Gadkari said in the letter to Goyal that he has received a representation from the All India Gem and Jewellery Domestic Council. Gadkari said they have raised an issue of lack of infrastructure for implementing mandatory hallmarking which may result in distress amongst the stakeholders.

In the post Covid pandemic scene, the gems and jewellery sector is the worst hit, Gadkari added. "They have sought relief in terms of postponement of order of implementation of mandatory hallmarking upto June 2022", Gadkari added in the letter.


The Council has also represented that their suggestions alongwith concerned authorities like BIS in the policy building process may be considered.

Amazon.in suffers brief outage for several users in India, up now New Delhi,

Amazon suffered a brief outage in some parts of India early on Thursday, affecting its website and shopping experience for several users. The website was up and running after about two hours of partial outage.Downdetector, a website that monitors app outages, showed a massive spike in problems on amazon.in that started around 10 am and continued till about 12 noon. It mentioned that the most problems faced by the Indians during the outage were logging into the website and checking out.

The company was yet to announce what caused the brief outage in India.

"There may be some technical issues in Amazon app today not only me but some of my friends also cant click/buy books on amazon today since morning. Please look into the matter," a user wrote on Twitter. "Is @amazonIN facing some glitch? Unable to place an order," another user posted.



added.

tioned

WESTERN RAILWAY-RAJKOT DIVISIOI **E-TENDER FOR PROVISION OF LIFT** E-Tender No.: 04 of 2021-22, Dt.:

Delays in power supply agreements (PSAs) for 7 GW

of the bid out renewable en-

ergy projects is one of the

main reasons that may lead

to 35 per cent shortfall in 160

GW renewable energy ca-

pacity target set for calendar

2022-end, ratings agency

not impact the credit profile

largely intact, supported by

benign module price trajec-

tory over past 18 months, it

bу

This delay may, however,

Crisil said on Thursday.

17.05.2021. e-Tender no.: DRM-RJT Division: Providing second lift for passenger connecting platform at Surendranagar Platforr Approximate Nit Cost: 25,30,235.73/- Date & time for Opening of Tender: 14.06.2021, 15:00 hours. Office Address: Divisional Railway Manager (Engg.), Wester Railway, Kothi Compound, Rajkot 360001 Website: www.ireps.gov.in.

Like us on : f facebook.com/WesternRly

Gujarat Water Supply & **Sewerage Board** Tender Notice No. 02 / 2021-22 Executive Engineer, P.H. Mechanical Division, GWSSB, 2nd floor.

Jal Bhavan, Adajan Road, Surat-395009. Phone No.: 9978407593 invites on-line tenders (ID No. 462257) for Comprehensive Operation, Maintenance and Repairing of electro mechanical works, works of all pumping machineries located at Palej Head Works of Dist: Bharuch under Northern Zone Bara Tract RWSS including proper supply of water to head works under the project maintenance of record etc. for 24 months at an estimated cost of Rs 34.89 lakhs from those who are registered in appropriate class and having work experience. The interested contractors shall have to pay required tender fee / EMD in prescribed manner. Further details and amendments made will be disburse only on Website www.nprocure.com. The last date of tender downloading/uploading is dated 03.06.2021 up to 18.00 hrs. For Drinking Water in Rural Area contact help line No. 1916 No.: Mahiti/Surat/139/2021



Gujarat Water Supply and Sewerage Board Tender Notice No. 06 / 2021-22



Group	Detail	Tender Fee Rs.	E.M.D. Rs.	Tender ID
Α	30 KVA to 125	900.00	25000.00	462259
	KVA Capacity			
В	140 KVA to 380	900.00	25000.00	462307
	KVA Capacity			
С	500 KVA to 1500	900.00	25000.00	462315
	KVA Capacity			

Water Supply Complaint Toll Free No. 1916

follows us on : witter.com/WesternRly

Closing time & Date for submission & opening of Bid :

પૂર્વ મુખ્યમંત્રી ૨મનસિંહ અને ભાજપ પ્રવકતા સામે એફઆઇઆ૨

ટુલકિટ મામલે ભાજપના આરોપો પર પલટવાર કરતા કોંગ્રેસે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી રમન સિંહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ એફઆઈઆર રાયપુરના સિવિલ લાઈન પોલીસ છત્તીસગઢ સ્ટેશનમાં એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ આકાશ શર્માએ કરાવી છે.

હકિકતમાં કોરોના સંક્ટની વચ્ચે રાજનીતિક દળોમાં શાબ્દીક યુદ્ધ છેડાયેલું છે. ભાજપ તરફથી પ્રવક્તા સંબિત પાત્રાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે તેમની એક ટૂલકિટના માઘ્યમથી આ સંકટના સમયે પીએમ નરેન્દ્ર મોદીને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યુ છે. કોંગ્રેસે આ આરોપોને જૂઠા ગણાવ્યા અને સંબિત પાત્રા પર એફઆઈઆર નોંધાવી છે. છત્તીસગઢ એનએસયુઆઈ તરફથી પૂર્વ સીએમ રમન સિંહ અને ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાની વિરુધ્ધ

જેના લગ્નના ૨૩ દિવસમાં

જ સુહાગ છીનવાઈ જાય તે

દુલ્હનની પીડાની કોઈ પણ

કલ્પના કરી ન શકે. જેના હાથ પર

મહેંદીનો રંગ હજી ઉતર્યો ન હતો

કે પતિ આ દુનિયાથી વિદાય થયો.

આ મામેલો એમ.પી.ના

રાજગઢનો છે. લગ્ન પછી ૨૩

દિવસ બાદ કોરોનાને કારણે

વરરાજાનું મોત નીપજ્યું હતું.

અજય શર્માનામનો ૨૫ વર્ષના

યુવાને કોરોના પ્રોટોકોલ હેઠળ

સંક્રમિત થઈ ગયો. લગ્નના થોડા

જ સમયમાં તેની તબિયત લથડવા

પોઝિટિવ આવ્યો હતો. તેની ૧૮

રિપોર્ટને સાર્વજનિક કર્યો છે. તેનાથી

આ દિલચશ્પ આંકડો સામે આવ્યો

છે કે રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમના પત્નીએ વર્ષ ૨૦૨૦માં

જેટલી કમાણી કરી છે. તેના કરતાં

વધારે ટેક્સ ઉપ રાષ્ટ્રપતિ કમલા

હેરિસ અને તેમના પર્તિએ ભર્યો છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ કાર્યાલય

વ્હાઈટ હાઉસ આંકડા પ્રમાણે

રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમના

પત્ની શિક્ષક પત્ની જિલની વર્ષ

૨૦૨૦માં કુલ આવક માત્ર ૬,૦૭,૩૩૬ ડોલર હતી. તે વર્ષ

૨૦૧૯માં ૯,૮૫,૨૨૩ ડોલરની

સરખામણીએ ઘણી ઓછી છે. આ

જોડીએ મળીને વર્ષ ૨૦૨૦માં કુલ ૧,૫૭,૪૧૪ ડોલરનો ટેક્સ

આપ્યો. બીજી બાજુ ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસ અને તેમના પતિ

ડાઉગ એમહોફની ૨૦૨૦માં કુલ

કમાણી ૧૬,૯૫,૨૨૫ ડોલર હતી.

આ પ્રમાણે તેમણે કુલ ૬,૨૧,૮૯૩

ડોલરનો ટેક્સ ભર્યો અને તેમના

માટે પ્રભાવી ટેક્સ રેટ ૩૬.૭ ટકા

ટેક્સ ભર્યો, રાષ્ટ્રપિત જો બાઈડેન

અને તેમની પત્નીની કમાણી તેનાથી

આ પ્રમાણે હેરિસ કપલે જેટલો

રહ્યો.

२२⋲२१५१०

લંગ્ન તો કર્યા.

રાચપુર, ફરિયાદ નોંધાવવામાં આવી છે. એફઆઈઆરમાં આઈટી

રિસર્ચ સેલના લેટરહેડને નકલી ગણાવતા અને તેનાથી ખોટી અને મનથી બનાવેલી સામગ્રી ઈન્ટરનેટ મીડિયા પર શેર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજ્ય અધ્યક્ષ આકાશ શર્માએ કહ્યુ કે સંબિત પાત્રાએ પોતાના ઓફિશિયલ ટ્વીટર પર થી કોંગ્રેસ પાર્ટીના નકલી લેટરહેડને શેર કર્યો. તો રાજ્યમાં સાંપ્રદાયિક હિંસા ભડકાવવાનો પ્રયાસ કરવા પર ડો. રમન સિંહ કરી રહ્યાનો આરોપ પણ ફરિયાદમાં કરાયો છે. ફરિયાદ આઈપીસી ૫૦૪, ૫૦૫(૧) બીસી, ૪૬૯, ૧૮૮ અંતર્ગત દાખલ કરવામાં આવી છે.

ટૂલકિટ કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ કે કોઈ સિક્રેટ હથિયાર નથી હોતું. તે એક સામાન્ય યાદી હોય છે. ટૂલકિટ એટલે કોઈ પણ સૂચનાઓની યાદી. ટૂલકિટને સરળ ભાષામાં સમજીએ તો જેવી રીતે નવરાત્રીમાં પાર્ટી પ્લોટના સંચાલકો આયોજન કરે છે અને આ

લગ્નના ચોથા દિવસે વરરાજા

પોઝિટિવ, ૨૩ દિવસમાં મોત

દરમિયાન લગ્ન કરતા રાજગઢમાં

એક પરિવારની ખુશી જીવનભર

માટે માતમમાં ફેરવાઈ ગઈ છે.

લગ્ન દરમિયાન વરરાજા કોરોના

સંક્રમણનો ભોગ બન્યો,

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના

આ ૨૫ વર્ષીય અજયનું ભોપાલમાં અવસાન થયું છે.

એપ્રિલના રોજ સિહોરમાં થયા

લાગી હતી અને માત્ર ૪ દિવસ હતા. લગ્ન થતાંની સાથે ૪ તેની પાલન કરવામાં આવ્યું હતું. આ પછી ૂતેનો રિપોર્ટ્ફોરોના તબિયત લથડતી હતી. ચાર દિવસ લગ્નૃ સિહોરના એક મંદિરમાં

ચાલી હતી, પરંતુ તેને બચાવી ઘરના અન્ય સભ્યોમાં એક નરસિંહગઢના મોતીપુરા ગામની

બાઈડેનની કમાણી કરતા

કમલા વધારે ટેક્સ ભરે છે

અમેરિકાના રાષ્ટ્રપતિ જો અમેરિકાના કાયદા પ્રમાણે ત્યાંના છે. રાષ્ટ્રપતિ જો બાઈડેન અને

શકાયો નહીં. કોરોના કાળમાં મહિલાપણ પોઝિટિવ મળી આવી એક યુવતી સાથે થયાં હતાં.

પરંતુ તે જ સમયે તે કોરોના રાજગઢ જિલ્લાના પચોરમાં રહેતા

દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો.

કોરોના કાળમાં દરમિયાન લગ્ન કરતા

રાજગઢમાં એક પરિવારની ખુશી જીવનભર

માટે માતમમાં ફેરવાઈ ગઈ

અજય શર્માના લગ્ન ૨૫ દીધો હતો. જો કે, અજયના

બાદ, ૨૯ એપ્રિલે અજયનો મર્યાદિત લોકોની હાજરીમાં થયા

પણ ઓછી છે. ઉલ્લેખનીય છે કે જાણકારી સાર્વજનિક કરવાની હોય

ઓક્સિજન ટેકર ફસાઈ જવા જેવી દુર્ઘટનાઓ ટાળવા પાકો રસ્તો બનાવ્યો

આગામી ચોમાસાને અનુલક્ષીને અને ગઇકાલે બનેલી ઓક્સિજન ટેક્કર

ફસાઈ જવા જેવી દુર્ઘટનાઓ ટાળવાની અગમચેતી રૂપે પાયોનીયર હોસ્પિટલ

ખાતે પાકો રસ્તો બનાવવાની તકેદારી જિલ્લા વહીવટી તેંત્રે લીધી છે. 📁 બુધવારે

પાયોનિયર હોસ્પિટલ કેમ્પસ ખાતે ભીની અને પોચી જમીનને મેંડીકલ

ઓક્સિજન લઈને આવેલું ભારે ટેક્રર ફસાઈ જવાના બનાવને અનુલક્ષીને તેમજ

આગામી ચોમાસાની ૠઁતુને ધ્યાને રાખીને ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું

પુનરાવર્તન ટાળવા ની તકેદારી માટે જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના મુજબ્

પાયોનિયર હોસ્પિટલ ખાતે માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા રોડ

બનાવવાની કામગીરી ખુબ જ ઓછા સમયમાં પૂર્ણ કરવામાં આવી છે.

આવી હતી.

દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે કેવી રીતે કામ કરવાનું છે તે અંગે એક સિસ્ટમ બનાવે અને તે યાદી સ્વરૂપે રજૂ કરે તેને ટૂલકિટ કહી શકાય. કોઈ કંપની પણ આવી યાદી બનાવીને પોતાની માર્કેટિંગ ટીમને આપી શકે છે.

ટૂલકિટને સિક્રેટ મિશન તરીકે પ્રસ્થાપિત કરવાની શરૂઆત ત્યારે થઈ જ્યારે દિલ્લીમાં આંદોલન કરી રહેલા ખેડૂતોને વિદેશમાંથી સમર્થન મળવા લાગ્યું હતું. વાત એવી હતી કે, દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિંગની લડાઇનો ચહેરો બનેલી બાળકી ગ્રેટા થંબર્ગે ખેડૂતોના આંદોલનના સમર્થનમાં ટ્વીટ કર્યું હતું અને એક ટૂલકિટનું ગૂગલ ડોક્ચુમેન્ટ રજૂ કર્યું હતું. જેમાં તેણે લખ્યું હતું કે, આપણે જેટલા પણ ખેડૂતોના હિત માટે લડી રહ્યા છીએ તે બધા એક કેમ્પેઇન કરીશું. તેણે કેટલાક હેશટેગ પણ સૂચવ્યા હતા કે, આ હેશટેગનો ઉપયોગ કરીને ટ્વીટ કરીશું જેથી ખેડૂતોના અવાજને વાચા મળે. જોકે, ગ્રેટો થંબર્ગે જાહેર કરેલી આ ટૂલકિટ કોઈ નવી ચીજ નથી.

હતી. રિપોર્ટ બાદ અજયની પહેલા

સ્થાનિક રીતે સારવાર કરવામાં

જ્યારે સ્થિતિ વધુ બગડતા તેને ભોપાલ લાવવામાં આવ્યો હતો. પરંતુ સંક્રમણ વધુ તીવ્ર બની

એક અઠવાડિયું વેન્ટિલેટર

પર રહ્યા પછી અજયે દમ તોડી

લગ્નમાં કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ

અજયના

'તોકતે' વોવાઝોડાની અસર, કેદારનાથમાં હિમવર્ષા થઇ

વેસ્ટર્ન ટાઇસ્સ

વાવાઝોડા 'તૌ કતે 'એ જબરદસ્ત રીતે દેશમાં વિનાશ વેર્યો છે. વાવાઝોડાની અસર એ રાજ્યો પર પણ પડી છે જ્યાં તેણે દસ્તક નહોતી દીધી. ઉત્તરાંખડમાં કાલથી વરસાદ થઈ રહ્યો છે. વળી, બદરીનાથ અને કેદારનાથના પહાડો પર પણ હિમવર્ષાના સમાચાર છે. અહીં કાલથી સ્નોફૉલ થઈ રહ્યુ છે જેના કારણે મે મહિનામાં લોકોને જાન્યુઆરીની ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તરાખંડમાં રેડ એલર્ટ

તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે પહેલા જ અહીં ભારે વરસાદની ચેતવણી આપી હતી. કેદારનાથમાં હિમવર્ષા, મેમાં જાન્યુઆરી જેવી ઠંડક દહેરાદૂન અને મસૂરીમાં સતત વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ૪૮ મિમી વરસાદ દહેરાદ્વમાં થયો છે. આટલો વરસાદ એક દિવસમાં છેલ્લા દસ વર્ષોમાં દહેરાદૂનમાં થયો નથી. સિમલી, ગૌચર, લંગાસૂ, નોટી, નંદાસેણ, નેનીસેણ સહિત બેનીતાલ, થરાલી, દેવાલ, ગૈરસૈંણમાં પણ વરસાદનો દોર ચાલુ છે. વળી, આજે ઉત્તરકાશી, ચમોલી, પિથોરાગઢ જનપદોમાં ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ દહેરાદૂન, ટ્હિરી, રુદ્રપ્રયાગ, પોડી, બાગેશ્વર, નેનીતાલ, હરિદ્વારમાં ભારે વરસાદ થઈ શકે છે. આઈએમડીએ અહીં રેડ એલર્ટ જારી કર્યુ છે. અહીં પણ વરસશે વાદળો પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્લી, પૂર્વોત્તર રાજસ્થાન અને ઉત્તરી મધ્ય પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ થઈ

४८ दिवसनो महायश थशे

કોરોનાથી બચવા માટે કોરોના દેવીનું મંદિર બનાવ્યું

કોચમ્બતૂર, કોરોના વાયરસ મહામારીને કારણે હાલ સમગ્ર દેશ સંકટ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં આંશિક તો અનેક રાજ્યોમાં પૂર્ણ લૉકડાઉન લાગુ છે. સંક્રમણથી બેચવા માટે પ્રોટોકોલનું પાલન તથા વેક્સીનેશનને યોગ્ય પદ્ધતિ માનવામાં આવી રહી છે. એક તરફ જ્યાં વૈજ્ઞાનિક પ્રયાસોથી કોરોના સંક્રમણનું પ્રબંધન અને નિયંત્રણના પ્રયાસો ચાલી રહ્યા છે તો કેટલાક લોકો આસ્થા અને ઇશ્વરીય શક્તિઓના સહારે કોરોનાને મ્હાત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગત થોડા દિવસોમાં દેશના અલગ-અલગ હિસ્સાથી કોરોના માતાની પૂજાના અનેક અહેવાલો સામે આવ્યા છે. હવે તાજેતરનો

મામલો તમિલનાડુના કોયમ્બતૂરનો છે. અહીં સ્થિત ઈરૂગ્રેમાં કમાચીપુરી આદિનામ મંદિરે કોરોના દેવીની મૂર્તિ બનાવી અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય કર્યો છે. મંદિરના મેનેજમેન્ટ મુજબ, આ દેવી લોકોને કોરોનાથી બચાવશે. આદિનામ મંદિર વહીવટદારો પૈકીના એક સિવાલીનેગેસ્વરરે કહ્યું કે પહેલા પણ પ્લેગ જેવી બીમારીઓથી બચવા માટે દેવીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. લોકોને રોગથી બચવા માટેની આ પરંપરા રહી છે.

રાજ્યમાં પહેલા પણ પ્લેગ મારિયામ્ન અને કેટલીક અન્ય દેવીઓની મૂર્તિઓ બની છે. આ મૂર્તિઓ વિશે લોકોનું માનવું છે કે તેનાથી પ્લેગ જેવા રોંગથી લોકોનો

જાહેર સૂચના पर्यावरणीय ङ्वीयरन्स

આ સાથે જણાવવામાં આવે છે સ્ટેટ લેવલ એન્વાયરમેન્ટ ઈમ્પેક્ટ અસેસમેન્ટ ઓથોરિટી પર્યાવરણ ભવન, સેક્ટર - ૧૦ એ, ગાંધીનગર -૩૮૨૦૧૦ દ્વારા મેસર્સ ચીડા કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ પ્લોટ નંબર ૩૦૧ થી ૪૩૦+ ૪૩૩ થી ૪૪૦/૨/૨, સાયખા ઈડસ્ટ્રિયલ એસ્ટેટ, તા-વાગરા, જી ભરૂચ, ગુજરાત -૩૯૨૧૪૦ ખાતે બલ્ક ડ્રગ અને ડ્રગ ઈન્ટરમીડિએટસના સૂચિત પ્રોજેક્ટ માટેની પર્યાવરણીય મંજૂરી ૧૧મે, ૨૦૨૧ના રોજ SEIAA/GUJ/EC/5(f)/596/2021 દ્વારા ઈ.આઈ.એ નોટીફ્રીકેશન તારીખ ૧૪ સેપ્ટેમ્બર ૨૦૦૬ જોગવાઈ હેઠળ આપેલ છે.

કલીયરન્સ પત્રની નકલ જીપીસીબી અને SEIAA/SEAC/GPCB વેબસાઈટ પર ઉપલબ્ધ છે

તારીખ ૨૦/૦૫/૨૦૨૧

મેસર્સ ચીડા કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ

બાઈડેન અને ઉપ-રાષ્ટ્રપૈતિ કમલા રાષ્ટ્રપતિ અને ઉપ-રાષ્ટ્રપતિના તેમના પત્નીએ ૩૦,૭૦૪ ડોલરની ROLCON ENGINEERING COMPANY LTD. હેરિસે પોતાના ઈક્રમ ટેક્સ રિટર્ન પરિવારને પોતાની નાણાંકીય ૨કમ ચેરિટી માટે પણ આપી છે. CIN: L29259GJ1961PLC001439

Reg. Office: Anand- Sojitra Road, Vallabh Vidyanagar-388120 (Gujarat) E-mail: rolcon@rolconengineering.com, web: www.rolconengineering.com

NOTICE

Notice is hereby given that the meeting of the Board of Directors of the Company will be held on Friday, May 28, 2021, at 4:30 p.m. at Registered office of the Company, to inter alia, to consider, take on record and approve the Audited Standalone and Consolidated Financial Result of the Company for the quarter and financial year ended on March 31, 2021, along with other agenda if any.

For, ROLCON ENGINEERING CO. LTD. Sd/- ASHISH S. AMIN

: May 20, 2021

Place: Vallabh Vidyanagar (Managing Director) (DIN: 01130354)

STP DEPARTMENT

E-TENDER NOTICE NO: 09/2021-2022

AHMEDABAD MUNICIPAL CORPORATION

પશ્વિમ રેલવે – રાજકોટ ડિવિઝન લિફ્ટની જોગવાઈ કરવા માટે ઇ–ટેન્ડર

ઇ–ટેન્ડર નંબરઃ ૨૦૨૧–૨૨નો ૦૪. તારીખ ૧૭.૦૫.૨૦૨૧. ઇ–ટેન્ડર નંબર ડીઆરએમ-આરજેટી-૨૦-ઈ-૪૧આર; **કામનું નામઃ** રાજકોટ વિભાગઃ સુરેન્દ્રનગર પ્લેટફોર્મ નંબર ૨/૩ ઉપર મુસાફરોના પ્લેટફોર્મ સાથે જોડાણ કરવા માટે બીજી લિસ્ટની જોગવાઈ કરવી. ટેન્ડરનું અપેક્ષિત ખર્ચ ૨૫,૩૦,૨૩૫.૭૩/- **ટેન્ડર ખોલવા**ની તારીખ અને સમયઃ ૧૪.૦૬.૨૦૨૧, ૧૫:૦૦ કલાકે. **ઓફિસનું સરનામું:** ડિવિઝનલ રેલવે મેનેજર (એન્જીનિયરિન્ગ), પશ્ચિમ રેલવે, કોઠી કમ્પાઉન્ડ, રાજકોટ ૩૬૦૦૦૧. **વેબસાઇટઃ** http://www.ireps.gov.in

લાઈક કરોઃ f facebook.com/WesternRly

Sr.No. Name of Work Operation & Comprehensive Maintenance with Repairing of all Electrical & Mechanical

nn

જાહેરાતો અંગે વાંચકોએ પોતાની

પશ્ચિમ રેલવે - અમદાવાદ

વીજળીકરણના કામો માટે ટેન્ડર નોટિસ

ઇ-ટેન્ડર નોટિસ નંબરઃ ઈએલ/સી

એડીઆઈ/જીએસ/૨૪૪/૨૦૨૦-૨૧**. સ્થ**ળ

સાથે કામનું નામઃ સુરેન્દ્રનગર-રાજકોટ-બ્રોડ ગેજ સિન્ગલ લાઈન વિભાગને (બાકી રહેલ

-જાહેરખબર મેનેજર

રીતે ચકાસણી કરી નિર્ણય લેવો.

Equipments & Instruments of Shantivan (Paldi) Sewage Pumping Station of AMC for

On-line Tender Submission up to :	Date: 14.06.2021 upto 18.00 Hrs.
Physical Tender Submission up to:	Date: 15.06.2021 upto 14.00 Hrs.
Tender opening Time & Date : (Only Technical Bid)	Date: 15.06.2021, 16.00 Hrs.
Details and Tenders available on:	www.nprocure.com

પશ્ચિમ રેલવે - અમદાવાદ <u> લેક્ટર્</u>ય કાઇક્સ (સર્વે અને બાંઘકામ), ઇ–ટેન્ડર નોટિસ વેસ્ટર્ન ટાઇમ્સમાં પ્રકાશિત

અને કે.સિએ(સી) III/એડીઆઈ/એસચૂકે–ડીએચએનએલ/૫૪, તારીખઃ ૧૯.૦૫.૨૦૨૧ કે. ચિક્ર એન્જીનિચર (બાંધકામ) III, શહેર કોટકા પોલિસ સ્ટેશન પાસે, સરસપુર, પો.ઓ. રેલવેપુરા, પશ્ચિમ રેલવે, અમદાવાદ-૩૮૦૦૦૨ ભારત દેશના રાષ્ટ્રપતિ તરફથી નિમ્નલિખિત કામો

ઇ-ટેન્ડર નોટિસ નંબરઃ ડે.સિએ(સી) III/એડીઆઈ/બીજી-એસઆઈઓબી/૫૩(આરઆઈ)

માટે ઇ-ટેન્ડર મંગાવે છે		X	
(૧) ઇ–ટેન્ડર ટેન્ડર નંબર	ડે.સિએ(સી) III/એડીઆઈ/બીજી-એસઆઈઓબી/પ૩(આરઆઈ)		
કામનું નામ	પશ્ચિમ રેલવેની વિરમગામ-સમંખિયાલી ડબલ લાઈનની ચોજના સંબંધિત જૂથમાં ગઠ્ઠાની વખારમાં ૫૦,૦૦૦ કમ પથ્થરના ગઠ્ઠાનો મશિન દ્વારા કરેલા ભૂકાનો પુરવઠો પૂરો પાડવો.		
કામનું અંદાજિત ખર્ચ	₹3,€3,00,000/-		
બાનાની રકમ	શૂન્ચ		
કામ પૂરું કરવાની અવધિ	૦૫ (પાંચ) માહિતી (ચોમાસા સહિત)		
ટેન્ડર જમા કરવાની અને ખ	ોલવાની અં	ાંતિમ તારીખ અને સમયઃ	
(i) બંધ થવાની તારીખ અ	ને સમય	૧૦/૦૬/૨૦૨૧, ૧૫:૦૦ કલાક	
(ii) ખોલવાનો સમય અને બોલીની તારીખ ૧૬:૦૦ કલાક, તારીખઃ ૧૦/૦૬/૨૦૨૧			
(૨) ઇ–ટેન્ડર ટેન્ડર નંબર ડે.સિએ(સી)ાા/એડીઆઈ/એસચૂકે-ડીએચએનએલ/૫૪			
કામનું નામ	સીઆરએસ નિરીક્ષણના પાલનના સંબંધમાં બી.જી એસઆઈઓબી વિભાગના એસચૂકે-ડીએચએનએલ વચ્ચે જુદા જુદા બાકી રહેલા કામનું બાંધકામ જેમ કે, નવી કિનારની સુરક્ષા માટે ટો વોલ, ફોપ/પડદાની દીવાલ, ફોર્મેશન સ્તર ઉપર ગુલાની દીવાલ, બન્ને ટ્રેક વચ્ચે કન્દ્રમાં નાળી, પિચિન્ગ અને સેસનું સમારકામ ઈત્યાદિનું કામ.		
કામનું અંદાજિત ખર્ચ	₹ ४,4८,८३,૯२७.54/-		
બાનાની રકમ	શૂન્થ બ્રવધિ ૦૫ (પાંચ) માદિતી (ચોમાસા સદિત)		
ટેન્ડર જમા કરવાની અને ખોલવાની અંતિમ તારીખ અને સમયઃ			
(i) બંધ થવાની તારીખ અને સમય 03/05/૨૦૨૧, ૧૫:૦૦ કલાક			
(ii) ખોલવાનો સમય અને બોલીની તારીખ ૧૬:૦૦ કલાક, તારીખઃ ૦૩/૦૬/૨૦૨૧			

ટેન્ડરનું પૂરું વર્ણન જોઈ શકાય તે નોટિસનું સ્થળ અને વેબસાઇટની વિગત અને ઓફિસનું સરનામું

http://www.ireps.gov.in, કે. ચિફ એન્જીનિચર (બાંધકામ)ની ઓફિસ, III, શહેર કોટડા

પોલિસ સ્ટેશન પાસે, સરસપુર, પો.ઓ. રેલવેપુરા, પશ્ચિમ રેલવે, ટેલિફોન નંબર ૦૭૯-

લાઈક કરોઃ f facebook.com/WesternRly 📗 ફોલો કરોઃ 💟 twitter.com/WesternRly

કે. ચિફ એર્ન્જીનિયર (બાંધકામ) III

અમદાવાદ

કામ) ડબલ લાઈનમાં બદલવાના કામના સંબંધમાં સુરેન્દ્રનગર-રાજકોટ વિભાગમાં સેવા સંબંધિત અલગ અલગ મકાનો, ઓફિસો, કેબલ હટ, એલસી ગેટ્સ, પ્લેટફોર્મ, કવર શેંડ અને કર્મચારીઓના રહેઠાણો માટે વીજળીકરણ. ટેન્ડરનું અપેક્ષિત ખર્ચઃ રુ.૧૧,૭૮,૯૭૯/ બાનાની રકમઃ આઈઆરઈપીએસ વેબસાઇટમ જણાવ્યા અનુસાર. ટેન્ડર જમા કરાવવાની અને ખોલવાની તારીખ અને સમયઃ આઈઆરઈપીએસ વેબસાઇટમાં જણાવ્ય અનુસાર. ટેન્ડરની કિંમતઃ આઈઆરઈપીએસ વેબસાઇટમાં જણાવ્યા અનુસાર. **કામ પુરું કરવ** માટેની અવધિ: ૦૬ મહિના જ્યાં ટેન્ડરનું વર્ણન જોઈ શકાય તે નોટિસ બોર્ડ અને વેબસાઇટની વિગત અને ઓ ફિસનું સરનામું: http://www.ireps.gov.in, નોટિસ બોર્ડ અને ડેપ્યુટી ચિક્ ઇલેક્ટીકલ એન્જીનિયર (બાંધકામ)ની ઓફિસ, પશ્ચિમ્ રેલવે કાળુપુર

અમદાવાદ (ગુજરાત ૩૮૦૦૦૨). કેપ્યુટી ચિફ ઈલેક્ટીકલ એન્જીનિયર (બાંધકામ) પશ્ચિમ રેલવે. અમદાવાદ અમને લાઈક કરો: 🕴 facebook.com/WesternRly





ડો. ચિરાગ પટેલ M.B.B.S., M.S. (Ortho) FISS Arthroscopy (ખભા અને ઘૂંટણના રોગના નિષ્ણાંત)

Sports Injury & Arthritis Clinic

આધુનિક પધ્ધતિથી દૂરબીન દ્વારા (ચીરા વગર) સાંધાના ઓપરેશન કરવાના નિષ્ણાંત સર્જન (હવે ઉપલબ્ધ છે તમારા આંણદ શહેરમા...)

શું તમે નીચે દર્શાવેલ સમસ્યાથી પીડાઇ રહ્યા છો ?

- ખભાનો સાંધો વારંવાર ખસી જવો (Dislocation)
- ♦ ખભો જકડાઇ જવો (Frozen Shoulder)
- 🕈 ખભા/ઘૂંટણના સ્નાયુ, તાણીયા કે ગાદીની ઇજા (Ligament /Tendon Injury)
- ♦ ખભા કે ઘૂંટણમાં ઘસારો કે ઇજા (Arthritis)
- 🕈 રમતગમતમાં થચેલ ઇજા (Sports Injury)

પરીમલ હેલ્થ કેર, નયાપડકાર પ્રેસની +91 8200692746 બાજુમાં, સ્ટેશન રોક, આણંદ-૩૮૮૦૦૧ +91 2692255383

સમય : દર શનિવારે (સવારે ૧૦ થી ૧) એપાઇન્ટમેન્ટ નંબર

સાંઇ ઓર્થોપેડીક હોરુપીટલ, (સોમ થી શનિ) થશ કોમ્પલેક્ષની સામે, ગોત્રી રોડ, વડોદરા-૩૯૦૦૨૧

પેટલાદ પંથકમાં ૬૩૦ વીજપોલ ધરાશાચી ૩૦ ગામોમાં હજીપણ અંધારપટ

ની વિભાગીય કચેરી આવેલ છે. જેના પંથકમાં આવેલ તાઉતે વાવાઝોડાને તાબા હેઠળ પેટલાદ, ખંભાત, તારાપુર અને સોજીત્રા તાલુકાઓનો સમાર્વેશ થાય છે. તાજેતરમાં તાઉતે વાવાઝોડાને કારણે પેટલાદ પંથકમાં ભારે તારાજી સર્જાઈ છે. આ વાવાઝોડાને લીધે એમજીવીસીએલના ૬૩૦ જેટલા વીજપોલ જમીનદોસ્ત થઈ ગયા છે. જ્યારે આ ચારેય તાલુકાના ૧૮૦ પૈકી ૩૦ ગામડાઓમાં હજી પણ અંધારપટ છવાયેલ એમજીવીસીએલની જૂદીજૂદી ટીમો યુદ્ધના ધોરણે કાર્યરત હોવાને લીધે

મળે છે. માહિતી એમજીવીસીએલની પેટલાદ વિભાગીય કચેરી હેઠળ ચાર તાલુકાઓનો સમાવેશ થાય છે. આ ચાર તાલુકાના ૧૮૦ જેટલા ગામડાઓ છે. જ્યા રહેઠાણ અને ખેતિવિષયક વીજ જોંડાણ કાર્યરત છે. આ વિભાગીય કચેરીના તાબા હેઠળ ૭ સબ ડિવિઝન આવેલ છે. જેમા પેટલાદ ટાઉન, પેટલાદ ગ્રામ્ય,

ખંભાત ટાઉન, ખંભાત ગ્રામ્ય,

(પ્રોસપેક્ટ નં.૮૪૩૦૦૫)

શ્રી. વિનુભાઇ સામજીભાઇ વાધરી, શ્રીમતી મનજીબેન વિનુભાઇ દાતણીયા, (પ્રોસપેક્ટ નં.૮૩૯૧૯૬ અને ૯૧૯૮૦૩)

શ્રી પિયુશભાઇ નરુભાઇ સરવેયા, શ્રીમત જાગુબેન પિયુશભાઇ સરવેયા (પ્રોસપેક્ટ નં.e૧૫૦૩૦)

શ્રી દિગ્વિજયસિંહ સબલસિંઘ રાઠોડ, શ્રીમતી પુર્ણાબા દિગ્વજયસિંહ રાઠોડ (પ્રોસપેક્ટ નં.આઇએલ૧૦૦७૨૦૪૮)

શ્રી દિનેશ રમેશભાઇ ધુરી, શ્રીમતી રત્નાબેન આર ધુરી (પ્રોસપેક્ટ નં.૮७૯૩૨૮)

(પ્રોસપેક્ટ નં.**૮૪૫૧૩૦)** શ્રી. દિલીપસિંહ મગનસિંહ પરમાર, શ્રીમતી જશીબેન દિલીપસિંહ પરમાર

પ્રોસપેક્ટ નં.૮७२७७૫)

શ્રી વિમલકુમાર વૈશ્વ, શ્રીમતી તનવીબેન વિમ

પ્રોસપેક્ટ નં.**૮૩૫७૪૪)**

શ્રી. રણવીરસિંહ પી. ચાવડા,

શ્રીમતી અલ્પા રણવીરસિંહ ચાવડા પ્રોસપેક્ટ નં.૮૯૮૪૮૨)

(ગ્રાસપઝર પટાઇટકટર) શ્રી શૈલેષ એમ. પરમાર, શ્રીમતી કિશ્માબેનો શ્રીયત ભાઇ પરમાર, શ્રી મનહરભાઇ પરમાર, શ્રીમતી ચંત્રીકાબેન પરમાર, ફેન્ડ્સ ફિટનેસ ક્લબ, હિરલ વિડ્યો શુટીંગ અને ફોટોગાફી પ્રોસપેક્ટ નં.૮૬૯૪૪૫)

શ્રી ભાનુભાઇ એમ રાણપરીયા, શ્રીમતી દક્ષાબેન ભાનુભાઇ રાણપરીયા, શ્રી. સંજય રાણપરીયા,

પ્રોસપેક્ટ નં.**૮૩૪૬૭૨ અને ૯૪૦૬૩૩**)

શ્રી સમીરભાઇ નારણભાઇ કાંસુદ્રા, શ્રીમતી અંજના સમીર કાંસુદ્રા, વેકરીયા એસોસીએટ્સ (પ્રોસપેક્ટ નં.૮૧૫૮૪૪ અને ૯૨૦૯૧૦)

શ્રી. જગદીશભાઇ રમાશંકરભાઇ જોશી, શ્રીમતી જયશ્રીબેન જે. જોશી,

શ્રી રામસિંઘ એન ગોરખા, શ્રીમતી હરીમાચા રામસિંઘ ગોરખા,

શ્રી પ્રકાશ ગુરખા (પ્રોસપેક્ટ નં.૮७૬૩૬૪ અને ૯૪૩૨૮७)

શ્રી નિલેશકુમાર રણજીતસિંહ વાઘેલા શ્રીમતી અંજનાબેન વાઘેલા પ્રોસપેક્ટ નં.૮૫૨૧૬૦)

શ્રી અરવિંદ ફુમાર પાંડે, શ્રીમતી શશીકલા દેવી, શ્રી વિનોદભાઇ પાંડે (પ્રોસપેક્ટ નં.૮૪૧૬૨૦)

પ્રોસપેક્ટ નં.**૮७૧૯૨૪)**

શ્રી. ઇમરાન અંસારી, એ.આર. ફેશન, શ્રીમતી રેહાના અંસારી

આગામી બે દિવસમાં તમામ વીજ

પુરવઠો પુનઃ કાર્યાન્વિત થવાનું જાણવા

જ્યારે ૧૭ સબસ્ટેશન અને ૧૧૩ સંદર્ભે કહ્યું હતુ કે ૧૧૩ પૈકી ૪૯ ફિડર આવેલ છે. તાજેતરમાં પેટલાદ ફિડર ખેતિવિષયક છે. પરંતુ ખેતરોમાં પેટલાદ ખાતે એમજીવીસીએલ ફિડર આવેલ છે. તાજેતરમાં પેટલાદ કારણે થયેલ ભારે નુકશાન સંદર્ભે વિસતૃત માહિતી આપતા કાર્યપાલક ઈજનેર ટી એસ વ્યાસે જણાવ્યું હતુ કે પવન અને વરસાદ સાથે ધસી આવેલ વાવાઝોડાને કારણે પેટલાદ વિભાગીય

વૃક્ષો પડી જવાની ઘટનાનું પ્રમાણ વધુ હોવાને કારણે આવા વિજ કનેક્શન બાદમાં ચાલુ કરવામાં આવશે. હાલ ગામડાના રહેણાંક વિસ્તારોમાં આવેલ વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવાની કામગીરીને પ્રાથમિક્તા આપવામાં



વિસ્તારમાં ૬૩૦ જેટલા વીજપોલ ધરાશાયી થયેલ છે. જેના કારણે ૧૮ થી વધુ ડીપી ડેમેજ થયેલ છે. ઉપરાંત આ વિભાગીય વિસ્તારના ૧૮૦ ગામડાઓનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો. જે પૈકી અત્યાર સુધી ૧૧૨ ગામડાઓમાં વીજ પુરવર્ઠો કાર્યરત થઈ ગયેલ છે. આજરોજ વધુ ૪૦ જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો પુનઃ કાર્યાન્વિત થશે. બાકીના ૩૦ ર્જેટલા ગ્રામ્ય વિસ્તારોમાં આગામી તારાપુર, સોજીત્રા અને ઉદેલ બે-ત્રણ દિવસમાં વીજ પુરવઠો ચાલુ સબડિવિઝનનો સમાવેશ થાય છે. થઈ શકે તેમ છે. ખેતી વિષયક જોડાર્જો

આવી છે. જેના માટે એમજીવીસીએલ અને કોન્ટ્રાક્ટ હેઠળની ટીમો એન્જીનિયરો સહિત કાર્યરત છે. ઉપરાંત બહારથી પંદર જેટલી ટીમો આજરોજ સાંજ સુધીમાં આવનાર છે, જેઓની કામગીરી આવતી કાલથી શરૂ થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે વાવાઝોડાથી અત્યંત પ્રભાવિત એવા ખંભાત તાલુકાના વાડોલા, નવાગામ વાંટા, નગરા, તામસા, હસનપુર, ગુડેલ, વડગામ, પાંદડ સહિત પંથકના ૩૦ ગામોમાં હજીપણ અંધારપટ

અાઇ આઇએકએલ હોમ કાઇનાન્સ લીમીટેડ (અગાઉ જાણીતી ઈન્ડીયા ઈન્ફોલાઈન હાઉસીંગ કાઇનાન્સ લિમીટેડ)ના નીચે સહી કરનાર અધિકારી સિક્કોરીટાઇઝાન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓક કાઇનાન્સ લીમીટેડ (અગાઉ જાણીતી ઈન્ડીયા ઈન્ફોલાઈન હાઉસીંગ કાઇનાન્સ લિમીટેડ)ના નીચે સહી કરનાર અધિકારી સિક્કોરીટાઇઝાન એન્ડ રીકન્સ્ટ્રકશન ઓક કાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્કોર્સમેન્ટ ઓફ સિક્ક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ ૨૦૦૨ અંતર્ગત અને વિક્કાયોરીટી ઇન્ટરેસ્ટ (એન્કોર્સમેન્ટ) ફલ્લ ૨૦૦૨ના નિયમ ૩ અને ક્રમ ૧૩ (૧) અન્ય મળેલી સાત્તાનો ગુએ નીચ દ્રશાહેલા દ્વાદાર- જામીનદારને સદર નીટિસ મળવાની તારીખલી ૧૦ દિવસની અંદર નોટિસમાં આપેલી અને નીચે મુજબની દર્શાવેલી ૨કમ ચૂકવલા ડિમાન્ટ નોટિસ પાઠલી હતી. દેવાદાર ૨કમ ચૂકવલામાં નિષ્ઠળ નીવડતા, દેવાદાર- જામીનદાર અને જાહેર જનતાને નોટિસ આપવામાં આવે છે કે નીચે સલી કરનાર અધિકારીએ કાયદાની કલમ ૧૩(૪) અને ઉપરોક્ત નિયમના નિયમ ૮ અન્ય મળેલી સત્તાની ગુએ નીચે દર્શાલેલી ભારતના કેબ્લ લીધો છે. આવી દેવાદાર અને જાહેર જનતાને ચેતલણી આપવામાં આવે છે એઝ સદર મિલકત સંદર્ભે કોઇ પણ લેવડ-દેવડ કરવી નહીં જો કોઇ વ્યક્તિ સદય મિલકત એને લેવડેલડ કરશે તો તોએ અહીં દર્શાલેલી ૧૬મ વ્યાજ સહિત IIHFLને ચૂકવનાની રહેશે. ઉધાર લેનારાઓ પ્યાપ્ત માપે કે, એક્ટની કલમ ૧૩ના પોટા કલમ (૮)ની જોગવાઇઓ માટે અનુસંધાને જો ઉધાર લેનારાઓ પાત્ર આઇએએએકએલની બાકી ચુકતો કરે છે, જે તમામ ખર્ચાઓ, ચાર્જિય ખર્ચ અન્ય ખર્ચ સાત્ર તે હોઇ પણ સમયે નિયત તારીખ પહેલાં વેચાણ અથવા દ્વાસર અને અન્સ અસ્ક્રયાનો આઇએચએકએલ દ્વારા આગળ કોઇ પગલું લેવામાં અવવા દ્વારા અપ્ર અને સરક્ષાનાનો આઇએચએકએલ દ્વારા આગળ કોઇ પગલું લેવામાં આવશે નહી.

દ્વાદારાળું ગાન	सुरादात ।मध्यतनु परान (स्थापर ।मध्यत)	୍ରିୟ ନାହା	SIMIOS	รผส
સુરત બ્રાંચ શ્રી. ભાવેશ સુર્યકાંત પટેલ,	ફ્લેટ નં. ૫૧૪ પાંચમો માળ આશરે ૧૮૯૫ સ્કે.ફીટ સુપર બિલ્ટઅપ એરીયા ૧૦૬૧ સ્કે. કાર્પેટ એરીયા અવિભાજય જમીન શેર સાથે સોહમ	લેણાની સ્ક્રમ રૂા.	નોટીસની તારીખ	નોટીસની તારીખ
વૈશાલી અનીલભાઇ ત્રિવેદી (પ્રોસપેક્ટ નં.૮૫૦૪૮૫ અને હ્ર્વ્૦૩૦૩)	રેસીડેન્સી બિલ્ડીંગ નં.ડી રેવેન્યુ સર્વે નં ૪૨૬ પૈકી ૧, સીટી સર્વે ઉત્તર નં.૪૨૪/એ/૧/બી અને ૪૨૯/એ/૨/બી, ટી.પી. સ્કીમ નં.૧ (લાલ દરવાજા), કાઇનલ પ્લોટનં.૨૫ વાર્ડ નં. એશ કતારગામ સીટી સુરત, ગુજરાત ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત	પ્રોસ્પેક્ટ નં.૮૫૦૪૮૫ રૂ.૧૨,૮૧,૩૫૪/- પ્રોસ્પેક્ટ નં.७૬૦૩૦૩ રૂ.૪૧,૮૨,૨७૩/-	૧૯-ફેબ્રુ-	૧૯-મે- ૨૦૨૧
શ્રી મેહુલભાઇ બાબુભાઇ ઇટાલીયા, શ્રી બાબુભાઇ એચ ઇટાલીયા, શ્રી મતી લાભુબેન બાબુભાઇ ઇટાલીયા અને સોહમ ડાયમંડ, (પ્રોસપેક્ટ નં.હcoova)	કલેટ નં.ઈ-૧૦૧, આશરે ૫૬.૮૭ સ્કે.મી. બિલ્ટઅપ એરીયા અવિભાજય જમીન શેર સાથે અમૃત રેસીડેન્સી રેવેન્યુ સર્વે નં.૪૨, બ્લોક નં.૩૪ આશરે ૮૬૦ સ્કે.મી. ટી.પી. સ્કીમ નં. ૨૫, કાઇનલ પ્લોટનં.૧૨૪ આશરે ૬૮૯૭ સ્કે.મી., બ્રહ્મામારોડ, મોજે ગામ મોટા વરાછા, પોકુલધામ સોસાયટીની સામે, સુરત, ગુજરાત ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત	રૂ.૧૯,૪७,૫૫૦/-	૧૮-ફેબ્લુ- ૨૦૨૦	૧૯-મે- ૨૦૨૧
રાજકુમાર એસ. કશ્યપ, શિવાની અને રાકેશ પાલ, (પ્રોસપેક્ટ નં.૮७૮૫૪૬)	કલેટ નં.૨૦૪, બિલ્ડીંગ નં.૭, શ્રી તિરૂપતી બાલાજી રેસીડેન્સી, મોજે ગામ શંકી, પલસાણા, સુરત, ગુજરાત ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત	₹. €,४€,3८٩/-	c-ടി श े-२०२०	૧૯-મે- ૨૦૨૧
વધુ માહિતી માટે અધિકૃત અધિકારીશ્રીની બાંચ ઓફિસ : ઓફીસ નં. ૭૦૧, સાતમો માળ, ૨૧મી સેન્ચ્યુરી બીઝનેસ સેન્ટર, ઉધના દરવાજા પાસે, રીંગ રોડ, સુરત- ૩૯૫૦૦૨) અથવા ક્ષે પોર્ટર ઓક્સિઝ : પ્લોટ નં ૯૮, કેસ-૪ ઉદ્યોગ વિઠાર ગરગાંવ હરીયાળા સંપર્ધ કરવો				

Shiros જોટીસ સિક્યારિટાઇઝેશન એન્ડ રિક્સ્ટ્રકશન ઓફ ફાઇનાન્સિયલ એસેટ્સ એન્ડ એન્ફોસંમેન્ટ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ, ૨૦૦૨ ની કલમ ૧૩ (૨) હેઠળ (આ કાયદો) સિક્યુરિટી ઇન્ટરેસ્ટ (એન્ફોર્સમેન્ટ) ટ્રલ્સ, ૨૦૦૨ ના નિયમ (આ નિયમો) ૩(૧) સાથે વાંચવામાં આવ્યો છે. ઉપારેત અધિનયમની કલમ ૧૩(૧૨) હેઠળ આપવામાં આવેલ સત્તાઓના ઉપયોગમાં આ નિયમોના નિયમ ૩ ની સાથે વાંચતા, આઇઆઈએકએલ ગુઠ કાઇનાન્સ લિમિટેડ (IRL HFL) (અગાઈ ઇન્સિયા ઈન્ડિયા ઇન્ફોલાઇન હાર્ડિસંગ ફાઇનાન્સ સિસિટેડ)ના અધિકૃત અધિકારીએ જારી કર્યા છે. ઉપારેત અધિનિયમની કલમ ૧૩ (૨) હેઠળ માંગજ્ઞી નોટિસ, ઉધાર હોઠલ કરે છે. ઉપરત્ના સંબંધિત ડિમાન્ડ નોટિસ (ઓ)માં જણાવેલ ટકમ પરત કરવા માટે હોઠલ કરે છે. ઉપરાના સંબંધમાં, ફરીથી આ સૂચના પ્રકાશિત થયાની તારીખલી ૧૦ દિવસની અંદર લેક્ષદાર (ઓ) ને યુકવળી કરવા માટે સુચના આપવામાં આવે છે, ના વધુ વ્યાજ સાથે, નીચે જણાવેલ ટકમ, ઓ માંગજ્ઞી સૂચના ચુકવણીની તારીખ સુધી લેક્ષદાર (ઓ) ની વિગત, તારીખ મુજબની રકમ માંગની સૂચના અને લોનની રકમની ચુકવણી માટે આપવામાં આવતી સુરક્ષા નીચે મુજબ છે:

ગદારો/ જામીનદારોના નામો	ડીમાન્ડ નોટીસ તારીખ અને રકમ	સિક્ચોર્ડ એસેટ (સ્થાઇ મિલ્કત)નું વર્ણન
ની નંદાબેન વનાજી ઠાકોર, ાનાજી ઘુળાજી ઠાકોર, પેક્ટ નં.૮૨૫७७૧)	૧૩-મે-૨૦૨૧ રૂા.૫,૩૧,૩૮૨/- (રૂપિયા પાંચ લાખ એકત્રીસ હજાર ત્રણસો બ્યાંસી ફક્ત)	ગામ પંચાયત મિલકત બીચરીંગ નં.७/૧૪૯, એસેમેન્ટ સીર નં.૧૪૬૮, આશરે ૫૧.૦૯ સ્કે.ફીટ. વાલમીચા વાસ, અલીહીર, ચ મંદિર, ઉંગા જીલ્લો, મહેસાણા, ગુજરાત ખાતે આવેલી મિલકત તેના બધા જ ભાગો સહિત
પુપતભાઇ ભાણાભાઇ સોલીયા તી દયાબેન ભુપતભાઇ સોલીયા પેક્ટ નં.૮૪૦૨૪૧)	૧૩-મે-૨૦૨૧ રૂા.ક,૩૫,૦૮૮/- (રૂપિયા છ લાખ પાંત્રીસ હજાર ઇઠ્યાસી ફક્ત)	ડી/હ૦૪સ એરીચાનું માપ ૪૧૯.૪૯ સ્કે.ફીટ. (સુપર એરીચા), ર સાથ, ઇઽ૦લ્યુએસ-૧૪, ટી.પી. ૨૯ મોટા વરાછા, સુરત, ગુજ પીનકોડ-૩૯૫૦૦૫ ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો ર
ામજીભાઇ કી. ભરવાડ, ગુજરાત શ્રી હરોભાઇ દાનાભાઇ ભરવાડ, તી જશુબેન રામજીભાઇ ભરવાડ પેક્ટ નં.૮૩૯૯७૮)	૧૩-મે-૨૦૨૧ રૂા.૨७,૯૯,૪૯૨/- (રૂપિયા સત્યાવીસ લાખ નવ્વાણું હજાર ચારસો બાણું ફક્ત)	એલજી-७, એરીચાનું માપ ૧૬૦ સ્કે.ફીટ. સુલાગન કોમ્પ્લેક્ષ, પાર્ક, વસ્ત્રાપુર, અમદાવાદ, ગુજરાત, પીનકોક-૩૮૦૦૧૫ ખાતે અ મિલકત અને તેના બધા જ ભાગો સહિત
ોતિમ બટુકભાઇ વેષ્ણવ, શ્રી હાર્દિક ભાઇ વેષ્ણવ, શ્રીમતી ઇન્દુબેન ભાઇ વેષ્ણવ, શ્રી કૃણાલ બટુકભાઇ વ, (પ્રોસપેક્ટ નં.૮૬૪૩૫૪)	૧૩-મે-૨૦૨૧ રૂા.૨૨,૪૮,૬૫૩/- (રૂપિયા બાવીસ લાખ અડતાલીસ હજાર છસો ત્રેપ્પન ફક્ત)	પહેલો માળ, આશરે ૨૬૨-૨७ સ્કે.મી. ફ્લેટ નં.૧૦૨, નિસર્ગ પે ઓમકાર સ્કુલની સામે, આશોપાલવ સોસાચટી, ફીજી પાન કોઠા રાજકોટ, પીનકોક-૩૬૦૦૦૪, ગુજરાત, ભારત ખાતે આવેલી મિ અને તેના બધા જ ભાગો સહિત

પાંચસો પંદર ફક્ત)

શ્રી મુળજીભાઇ બગાડા, શ્રીમતી હંસાબેન ૧૩-મે-૨૦૨૧ રૂા.૨૦,૭૮,૩૨૯/-(રૂપિયા વીસ લાખ ઇક્સોતેર ઇમ્પ્રેક અમનગર, પ (રૂપિયા વીસ લાખ ઇઠ્યોતેર હજાર ત્રણસો ઓગણત્રીસ કકત) 35૧૦૦૫, ગુજરાત, ભારત ખાતે આવેલી મિલકત અને તેના બધા ૧ ભાગો સહિત

એફ-૨, પહેલો માળ, આશરે ૧૪.૨૪ સ્કે.મી. આવાસ કોમર્સીચલ કોમ્પ્લેસ, મોરેચા, ચાંગોદર, અમદાવાદ, ૩૮૨૧૧૦, ગુજરાત, ભારત ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત ૮૩૯૧૯**૬ રૂા.૬,૯૨,૮૧૦/-**(રૂપિયા છ લાખ બાણું હજાર શઠસો દસ ફક્ત) **પ્રોસ્પેક્ટ નં ૯૧૯૮૦૩ રૂા.૧,૨૨,૦૧૧/-**(રૂપિયા એકૂ લાખ બાવીસ હજાર

. ૨૪૮૯-૫૬૮લ્લુએસ-એલ, ઇડલ્લુએસ૧/૮૩૬ ટીપી સ્કીમ તાં.૨/એ, પ્લોટ તાં.૧૬, ક્લેટ તાં ઇ-૯૦૩, અમલીલ જકાતનાકાની સામે, સ્વવ્ન સાકાર, ભાવનગર, ગુજરાત, પીનકોક-૩૬૪૦૦૧ ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત ૧૫-મે-૨૦૨૧ રૂા.૩,૧૩,૫૧૫/ ૧૫-મે-૨૦૧૧ રૂા.૧,૫૬,૧૯૯/-(રૂપિયા એક લાખ છપ્પન હજાર એકસો નવ્વાશું કેક્ત) 35૪૦૦૧ ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત

જાડતા વધ્યાલું કરતા) વપ-મે-૨૦૨૧ પ્રોસ્પેક્ટ છં. ૮૦૧૩૦૪ રૂા. ૧૬, ૨૪, ૩૪/૩/ (રૂપિયા સોળ લાખ ચોવીસ હજા. ત્રાસાને ત્રેસ દંકત) પ્રોસ્પેક્ટ છં. ૯૧૮૭૫૯ રૂા. ૧, ૧૮, ૨૮૭/ (રૂપિયા એક લાખ અહાર હજા. બસો સીત્યાસી કંડતા ૧૫-મે-૨૦૨૧ રૂા. ૧૨, ૯૩, ૩૧૧/ ઉપિયા બોડ લાખ ત્રાલે હજા. ફ્લેટ નં.૫૦૬, પાચમો માળ પ્રભાકુંજ ફ્લાવર્સ ક્લીલપોર નવસારી ગુજરાત ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત

ઇ/૩૦૬, આશરે ૫૫ સ્કે.સાર્ડ, વૃંદાવન ફ્લેટ, બાંધકામ સર્વે નં.૧૮૮, ટી.પી. સ્ક્રીમ નં.૧, જીગ્નાશા સોસાચર્ટીની સામે, વેજલપુર, અમદાવાદ, ૩૮૦૦૫૧, ગુજરાત, ભારત ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત ૧૭-મે-૨૦૨૧ રૂ.૧૬,૨૫,૯૯૨/-(રૂપિયા સોળ લાખ પચ્ચીસ હજાર નવસો બાશું કક્ત) સામ માર્ગ સાથે કહ્યા પ્રાથમાશા, સુરત, પીનકોક-૩૯૪૦૧૦, ગુજરાત, ભારત ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત

૧૫-મે-૨૦૨૧ રૂ.૪,૫૪,૧૧૩/-(રૂપિયા ચાર લાખ ચોપ્પન હજાર એકસી તેર કક્ત) વ્રાપ્ય ભારત ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત

૧૫-મે-૨૦૨૧ રૂ.૫૦,૪૮,૬૧૯/-(રૂપિયા પચાસ લાખ અડતાલીસ રોડ, ચાંદખેડા, અમદાવાદ, ગુજરાત, પીનકોક-૩૮૨૪૪૪ ખાત આવેલી હજાર છસો ઓગણીસ કંડત) મ્ય-મે-૨૦૨૧ રૂ. ૨૨,૧૪,૩૬૩]- પ્લોટ નાં ૧, પહેલો માળ, એરીચા આશરે ૧૮૨૪ રસ્કે.ફીટ. હોલ નાં (રૂપિયા બાવીસ લાખ ચૌદ હજાર ત્રણસો ત્રેસઠ ૬૬ત) ગુઆઇડીસીની પાસે, સુરત-૩૯૪૩૨૫, ગુજરાત ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત

૧૫-મે-૨૦૨૧ **ર.૧૮,७७,૮૦૮/-**(રૂપિયા અઢાર લાખ સીત્યોતેર હજાર આઠસો આઠ ફક્ત) ૧૫-મે-૨૦૨૧ પ્રોસ્પેક્ટ નં.

- પ્લોટ નં.૧૫૬, એરીચાનું માપ ૪૫.૭૧ સ્કે.મી. રાજ નંદીની રેસીડેન્સી-૩, બ્લોક નં.૧૧૬, ઉમરા, ઓલપાડ, સુરત, પીનકોડ-૩૯૪૫૪૦ ગુજરાત ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત પ્લોટ નં.ડી-૧૯, એરીચાનું માપ કર.૫૦ રકે.ચાર્ડ, સાગર સોસાચટી, ઝાર.એસ. નં.૨૩ પૈકી, એસએમસી પાર્ટી પ્લોટ, એલ.એચ. રોડ, એલ.એચ. 35, સુરત, ગુજરાત, પીનકોડ-૩૯૫૦૦૬ ખાતે આવેલી મિલકત અને તેના ખધા જ ભાગો સહિત

૮૩૪૬७૨ રૂા.૪૨,७૬,૧૬૩/-(રૂપિયા બેતાલીસ લાખ છોત્તેર હજાર એક્સો ત્રેસઠ ફક્ત) **પ્રોત્પેક્ટ નં.૯૪૦૬૩૩ રૂા.૩,૦૨,૧૪૪/-**(રૂપિયા ત્રણ લાખ બે હજાર એક્સો

ચુમ્માલીસ ફક્ત) પ-મે-૨૦૨૧ **રૂ.૮,७૪,૯૮૦/-**(રૂપિયા આઠ લાખ ચુમ્મોતેર હજાર નવસો એંસી ફક્ત) સર્વે નં.૪૨, ૫૪, ૬७, ટેનામેન્ટ નં.૫૧૭૬, આશરે ૩૫ સ્કે.મી. હરીઓ નગર, મોજે તરસામીચા, ઓફ ગોઘરા રોડ, જી.એચ. બોર્ડ, ભરતનગર ગુજરાત ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત ૧૬-મે-૨૦૨૧ પ્રોસ્પેક્ટ નં. પ્લોટ નં.૧૦७, કૃષ્ણકુંજ સોસાચટી, કામરેજગામ, સુરત, ગુજરાત ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત

૮૧૫૮૪૪ રૂ.૩૪,૦૨,૬૮૩/-(રૂપિયા ચોત્રીસ લાખ બે હજાર છસો ત્યાંસી ફક્ત) **પ્રોત્યેક્ટ નં.૯૧૦૯૧૦ રૂ.૨,૫૧,૦૦૧/-** (રૂપિયા બે લાખ એક્કાવન હજાર એક ફક્ત)

૧૯-મે-૨૦૨૧ રૂ.૧૬,૬૮,૨૫૯/-(રૂપિયા ઓગણીસ લાખ અડસઇ કજાર બસો અગણ્યા સાંઇઇ કંક્ત) પાસે, જુણુ બસો અગણ્યા સાંઇઇ કંક્ત) ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત

આઇરીસ-૧૦૦૧, આશરે કુલ કાર્પેટ એરીચા ૫૩.૯૦ સ્કે.મી. અને અવિભાજ્ય જમીન શેર ૧૮.૪૧ સ્કે.મી. ૧૦મો માળ, ટાવર-આઇરીસ ગ્રીન હેવેન, એટલાર્દેશ, પાદરા મેઇન રોડ, વડોદરા, ૩૯૦૦૧૨, ગુજરાત, ભારત ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત ટાઇન્ડિક્ટર રૂ. ૨૨, ૫૧, ૬૪૧/-(રૂપિયા બાવીસ લાખ એક્કાવન હજાર ઇસો એક્તાલીસ કંક્ત) પ્રોમેક્ટ નં.૯૪૩૨૮७ રૂ.૧,૦૮,૬૯७/- (રૂપિયા એક લાખ આઠ હજાર ઇસો સત્તાહું ફંક્ત)

ુષ્કાને-૨૦૨૧ સ.હ.૮૫,૩૯৬/-(રૂપિયા સાત લાખ પંચ્યાસી હજાર રોડ, વટવા, અમદાવાદ-૩૮૨૪૪૦, ગુજરાત, ભારત ખાતે આવેલી ત્રણસો સત્તાણું કક્ત) મિલકત અને તેના બધા જ ભાગો સહિત શ્રી રમેશ ભાટી, શ્રીમતી કંચન ભાટી, (પ્રોસપેક્ટ નં.૮૨૨૦૬૩) ત્રણસો સત્તાણું ફક્ત) પ્રી મોહનભાઇ હમીરભાઇ પ્રીમતી જશુબેન મોહનભ પ્રોસપેક્ટ નં.૮૫૧૮૦૫)

૧૭-મે-૨૦૨૧ રૂ., ૪૩, ૨૫૯/-(રૂપિયા ત્રણ લાખ તેતાલીસ હજીર **સુરેંડન્ડનગર, ગુજરાત** ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો બસો અગણ્યા સાંઇઠ કક્ત) સહિત ૧૭-મે-૨૦૨૧ રૂ.ક.૨૫,૯૪૧/-(રૂપિયા છ લાખ પચ્ચીસ હજાર નવસો એક્તાલીસ કક્ત) બધા જ ભાગો સહિત

હ-મે-૨૦૨૧ રૂ.૧७,૪૩,૫૧૩/-(રૂપિયા સત્તર લાખ તેતાલીસ હજાર પાંચસો તેર કંક્ત) ભાગો સહિત

વપ-મે-૨૦૨૧ પ્રોસ્પેક્ટ તં. ૮७૦૦૧૨ રૂ.૧૩,૬૩,૧૨૬/- (રૂપિયા તેર લાખ ત્રેસક હજાર એક્સો ઇન્લીચે કંકતો ભારત ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત ભારત ખાતે આવેલી મિલકત અને તેના બધા જ ભાગો સહિત શ્રી. વિષ્ણુભાઇ ગાંડાભાઇ વાળંદ, શ્રીમતી રંજનબેન વી વાળંદ, (પ્રોસપેક્ટ નં.૮७૦૯૧૨ અને ૯૨૧७૮૬) પ્રોસ્પેક્ટ તં.૯૨૧૧७૮૬ રૂ.૨,૧७,૨૩૬/- (રૂપિયા બે લાખ